



T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયનોના માથે 17 વર્ષ પછી લાગી કાળી ટીલી

દસ દિવસ પહેલા, કદાચ વિશ્વના અગ્રણી ક્રિકેટ પંડિતોએ 2026 T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના ભાગ્યની કલ્પના કરી હશે. ઓસ્ટ્રેલિયાનું T20 વર્લ્ડકપ અભિયાન શરૂ થાય તે પહેલાં જ પાટા પરથી ઉતરી ગયું હતું, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ ઈજાઓને કારણે બહાર થઈ ગયા હતા. આયર્લેન્ડ સામેની ઓપનિંગ મેચ પહેલા, કેપ્ટન માર્શ ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે પ્રથમ બે મેચ ગુમાવી દીધી હતી. માર્શની ગેરહાજરીમાં ટ્રેવિસ હેડ કેપ્ટન બન્યો પછી, ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડ સામે જીત મેળવીને સકારાત્મક શરૂઆત કરી. જોકે, આગામી મેચમાં સૌથી મોટો આંચકો લાગ્યો, કારણ કે તેમને સિકંદર રજાની આગેવાની

T20 વર્લ્ડકપમાં કાંગારૂઓ પોતાના મુકામની શોધ કરતા રહ્યા પણ સોમવારે શ્રીલંકા સામે 8 વિકેટથી હારનો સામનો કર્યા પછી, ઓસ્ટ્રેલિયા વેન્ટિલેટર પર જ હતું. તેમને વિવિધ પ્રાર્થનાની જરૂર હતી, પરંતુ જ્યારે વરસાદે ઝિમ્બાબ્વે-આયર્લેન્ડ મેચ ધોવાઈ ગઈ, ત્યારે તેમની બાકીની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું અને તેઓ 17 વર્ષ પછી ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઇ ગયા

પાંચ પોઈન્ટ છે. તેમણે ઓમાનને હરાવીને અને ઓસ્ટ્રેલિયાને બહાર કરીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ ફક્ત બીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાં બહાર થયું છે . 2009 માં, ટીમ ગ્રુપ સ્ટેજમાં પણ બહાર થઈ ગઈ હતી. સોમવારની હાર પછી, કાંગારૂઓ વર્લ્ડકપમાં જીવંત રહેવા માટે વેન્ટિલેટર પર હતા. અહીંથી ક્વોલિફાય થવાની તેમની શક્યતાઓ ફક્ત 20



હેકળની ઝિમ્બાબ્વે સામે 23 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હારથી શ્રીલંકા સામે ભૂલ માટે કોઈ અવકાશ રહ્યો નહીં, જો કે તેમ છતાં તેઓ તેનો યોગ્ય ઉકેલ શોધવામાં નિષ્ફળ ગયા. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી બે મેચ હારી ગયું છે. ટીમના ફક્ત બે પોઈન્ટ છે. તેમને ઓમાન સામે પોતાનો અંતિમ મેચ રમવાનો છે. તે મેચમાં જીત મેળવવાથી પણ ટીમને ફક્ત ચાર પોઈન્ટ મળશે. દરમિયાન, ઝિમ્બાબ્વેના ફક્ત ત્રણ મેચમાં

ટકા હતી, અને તેઓ અત્યંત મુશ્કેલ સ્થિતિ હતા. અને આજે, મંગળવારે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયા બાદ, ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયું. આ જ આ ફોર્મેટની સુંદરતા છે. વર્લ્ડકપમાં જીવંત રહેવાના તેમના મરણિયા પ્રયાસમાં, સાથી યજમાન શ્રીલંકાએ સોમવારે પલ્લેક્લમાં કાંગારૂઓને 8 વિકેટથી હરાવ્યું, જેનાથી તેઓ લગભગ વર્લ્ડકપમાંથી બહાર થઈ જવાના આરે

છેલ્લે 2009માં વર્લ્ડકપના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયા હતા. ઝિમ્બાબ્વેએ બે-ત્રણ દિવસ પહેલા જ કાંગારૂઓનો સ્વાદ અટકાવેલો હતો. ઓસ્ટ્રેલિયા ટીમો હતો કે શ્રીલંકા સામે 8 વિકેટથી હારતાં સુધીમાં તે વધુ તીવ્ર બની ગયો હતો. શ્રીલંકાની ધીમી વિકેટ કાંગારૂઓ માટે ધીમા ઝેર જેવી બની ગઈ. આવી સ્થિતિમાં, ઝિમ્બાબ્વે સામે પાછળથી બેટિંગ કરવી કે શ્રીલંકા સામે પહેલા બેટિંગ કરવી કોઈ સમસ્યા નહોતી. બંને મેચમાં,

દેવદત્ત પડિકલ : કેપ્ટનશીપની ભૂખ અને ભારત માટે રમવાનું સ્વપ્ન

કર્ણાટક અને ઉત્તરાખંડ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફી સેમિફાઇનલના બીજા દિવસે કર્ણાટકના કેપ્ટન દેવદત્ત પડિકલે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારી હતી . ૩૩૦ બોલમાં ૨૨૨ રનની ઈનિંગ રમ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા પડિકલે કહ્યું કે તે આ વખતે બેવડી સદી ફટકારવાની તક ગુમાવવા માંગતો નથી. પડિકલનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર ૧૯૮ રનનો હતો , જે તેણે ૨૦૨૩-૨૪ રણજી ટ્રોફી દરમિયાન પંજાબ સામે બનાવ્યો હતો. જોકે, તે દરમિયાન તે બેવડી સદી ચૂકી ગયો હતો.

ઉત્તરાખંડ સામે રમાયેલી રણજી ટ્રોફી સેમી ફાઇનલના બીજા દિવસે કર્ણાટકના કેપ્ટન દેવદત્ત પડિકલે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારી અને તેની સાથે જ તેણે ભારત માટે રમવાની આશા વ્યક્ત કરી

કરે છે, પરંતુ પડિકલે કોઈ ભૂલ કરી નહીં. તેમણે કહ્યું, તમારે તમારી ભૂખ જાળવી રાખવી પડશે. તમારે પોતાને યાદ કરાવતા રહેવું પડશે કે આવી તકો દરરોજ આવતી નથી. રણજી સિઝન દરમિયાન



તક ગુમાવી ન હતી. મધ્યપ્રદેશ સામેની હાર બાદ, કર્ણાટકની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા, અને પડિકલને સીઝનના મધ્યમાં કર્ણાટકના રણજી ટ્રોફી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, મયંક અગ્રવાલના સ્થાને. કુરુણ નાયર અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ અનુભવી ખેલાડીઓની હાજરીને ધ્યાનમાં રાખીને, યુવાન પડિકલને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય મહત્વપૂર્ણ હતો.

કેપ્ટનશીપ મેળવવા અને સિનિયર ખેલાડીઓ સાથે કામ કરવા વિશે વાત કરતા, પડિકલે કહ્યું, જ્યારે તમારી સાથે સ્થાપિત અને અનુભવી ક્રિકેટરો રમતા હોય ત્યારે તે હંમેશા સારું લાગે છે. હું કેપ્ટન છું કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ આ ખેલાડીઓ સાથે રહેવાથી મને ફાયદો થાય છે. જ્યારે પણ મને કોઈ સમસ્યા હોય છે, ત્યારે હું તેમની પાસે જાઉં છું અને તેઓ મને મદદ કરે છે. શરૂઆતની કેટલીક મેચોમાં તેમને મારી સાથે રાખવા એ મારા માટે કેપ્ટન તરીકે આશીર્વાદ સમાન હતું.

પડિકલ સતત ભારતીય ટીમના સેટઅપનો ભાગ રહ્યા છે અને હજુ પણ છે. જોકે, દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ઘરઆંગણેની ટેસ્ટ શ્રેણીમાં તેમને તક મળી ન હતી અને તેઓ બેન્ચ પર જ રહ્યા. પડિકલ એ પણ સમજે છે કે ભારતીય ટીમના સેટઅપમાં રહેવું અને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું હવે સરળ નથી. તેમણે કહ્યું, આ સંઘર્ષ હંમેશા રહ્યો છે અને બધા જાણે છે કે આજકાલ જે કેપ્ટરનું ક્રિકેટ રમાઈ રહ્યું છે, તેમાં સ્પર્ધા ખૂબ જ કઠિન બની ગઈ છે. તમારે સતત પ્રદર્શન કરતા રહેવું પડશે. તમારું લક્ષ્ય સ્વાભાવિક રીતે ભારત માટે રમવાનું છે અને હું હંમેશા આ સ્વપ્નને જીવંત રાખું છું. જોકે, આ દરમિયાન, હું જ્યારે પણ મેચ રમવા જાઉં છું ત્યારે રન બનાવવાનો અને મારી ટીમને મેચ જીતવામાં મદદ કરવાનો પ્રયાસ કરું છું. ખાસ કરીને કર્ણાટક જેવી શક્તિશાળી ટીમની કેપ્ટનશીપનો બોજ ચોક્કસપણે ખેલાડી પર દબાણ લાવે છે. જોકે, પડિકલે સ્વીકાર્યું કે બેટ્સમેન તરીકે તેની રમત બદલાઈ નથી. તેમણે કહ્યું, મને નથી લાગતું કે કેપ્ટનશીપથી મારી રમત બદલાઈ છે. જોકે, તે તમારા પર જવાબદારી મૂકે છે. આવા સમયે, તમારી રમવાની શૈલીને અસર ન થવા દેવી મહત્વપૂર્ણ છે, અને હું એ જ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.

ઈશાન કિશન વર્તમાનમાં જીવંતો એક જીંદાદીલ ખેલાડી

19 60ની બોલિવૂડ સુપરહિટ ફિલ્મ વક્ત નું આશા ભોંસલેનું ગીત 'આગે ભી જાને ના તુ, પીછે ભી જાને ના તુ, જો ભી હે બસ યેહી એક પલ હે' ઈશાન કિશનનું પ્રિય ગીત ન હોઈ શકે, પરંતુ આ પંક્તિઓની ભાવના તેની કારકિર્દીની વાતોને સંપૂર્ણ રીતે બંધબેસે છે. પટ્ટાનાનો ૨૦ વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન એવા સમયથી પાછો ફર્યો છે જ્યારે ભારતીય ક્રિકેટ જગત તેના પર આશા ગુમાવવા લાગ્યું હતું. ઋષભ પંત T20 વર્લ્ડકપ વિજેતા ટીમમાં પાછો ફર્યો હતો, ધ્રુવ જુરેલ અસરકારક પ્રદર્શન કરી રહ્યો હતો, સંજુ સેમસન હંમેશાની જેમ દાવેદાર હતો, અને જીતેશ શર્મા પણ પોતાની યોગ્યતા સાબિત કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, પસંદગીના ક્રમમાં પાંચમા ક્રમે રહેલો કિશન લગભગ બંધ થઈ ગયો હોય તેવું લાગતું હતું.

આ આક્રમક બેટ્સમેન માટે સતત અનિશ્ચિતતામાં જીવવું સરળ નહોતું. માનસિક થાકને કારણે કિશનએ વિરામ લેવાનું નક્કી કર્યું. જોકે, ત્યારબાદ તેને પસંદગીમાંથી બહાર કરી દેવામાં આવ્યો, તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો, અને તેના પર સ્થાનિક ક્રિકેટ પ્રત્યે ગંભીર ન હોવાનો આરોપ મુકવામાં આવ્યો. તેના નજીકના મિત્ર અંશુમત શ્રીવાસ્તવે કહ્યું, બીજા જ દિવસથી, લોકોએ માની લીધું કે તે ક્રિકેટ પ્રત્યે ગંભીર નથી. બધી પ્રકારની વાતો લખાઈ ગઈ. જોકે, કિશન ક્યારેય આ બાબતો પર પ્રતિક્રિયા આપતો નહોતો. તે હસતો રહ્યો અને સખત મહેનત કરતો રહ્યો. વર્તમાનમાં જીવવું મુશ્કેલ છે, પરંતુ તે પ્રક્રિયાને સર્વોપરી માનતો હતો. અંશુમતના મતે, આજે તમે પાકિસ્તાન સામે જે જોઈ રહ્યા છો તે બે વર્ષ પહેલાં શરૂ કરેલી પ્રક્રિયાનું પરિણામ છે. આ રન તે પ્રક્રિયાનો એક ભાગ છે. અંશુમત પટ્ટાના સ્થિત ઈશાન કિશન ક્રિકેટ એકેડેમીના સહ-સ્થાપક પણ છે અને આ સમયગાળા દરમિયાન કિશનની મહેનતનો સાક્ષી છે.

આ મુશ્કેલ સમયગાળા દરમિયાન, કિશનના પરિવાર અને નજીકના મિત્રો, અંશુમત સાથે, તેને એક રક્ષણાત્મક વર્તુળ પૂરું પાડ્યું. તેના પિતા, પ્રણવ પાંડે, તેના મોટા ભાઈ અને તેના ચિકિત્સક, રાજ કિશન, ભાવનાત્મક ટેકો પૂરો પાડ્યો.

રણજી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, કે વિજય હજારે ટ્રોફીમાં તેમણે કેટલા રન બનાવવાના હતા. ન્યુઝીલેન્ડ સીરિઝ અને સ્થાનિક ક્રિકેટમાં તેમનો સરેરાશ ઉત્તમ હતો. કિશન, જે આઉટગોઈંગ અને ખુશમિજાજ છે, તેને ટીમનું વાતાવરણ હળવું રાખવાનું પસંદ છે. અંશુમતે કોલંબો ફક્ત પાકિસ્તાન મેચ જોવા માટે જ નહીં પરંતુ તેના ભાઈ સાથે રહેવા માટે પણ આવ્યો હતો. તેણે કહ્યું, તે

નેટ સત્રોમાં સેંકડો વખત , વિવિધ પરિસ્થિતિઓનો અભ્યાસ કરીને ઇશાને પાવરપ્લેમાં તેને કેટલા રનની જરૂર પડશે , લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેને કેટલા બોલની જરૂર પડશે જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરી . આ બધું માનસિક તૈયારીનો ભાગ હતું

મજાક કરવાનું અને મજાક સાથે વાતાવરણ હળવું રાખવાનું પસંદ કરે છે. તેમના હળવા સ્વભાવને ઘણીવાર ગંભીરતાનો અભાવ માનવામાં આવે છે, પરંતુ તે ફક્ત એક ધારણા છે. પાકિસ્તાન સામે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા પછી, હોટેલ પરત ફર્યા પછી, તેણે પહેલા રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે બુધવારે નેધરલેન્ડ્સ સામે મેચ છે. પટનાની એકેડેમીમાં કૌશલ્ય પ્રેક્ટિસ દરમિયાન તેના મોટા ભાઈ રાજ કિશને ખાસ ભૂમિકા ભજવી હતી. અંશુમતે કહ્યું, રાજ જુનિયર ક્રિકેટ રમ્યો હતો અને હવે ડૉક્ટર છે. કિશનની રમતને તેના

કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકતું નથી. તેની સલાહ મહત્વપૂર્ણ છે. કિશન એકેડેમીમાં કલાકો સુધી સિમ્યુલેશન (મેચ જેવી પરિસ્થિતિઓનું અનુકરણ) માં પ્રેક્ટિસ કરીને તેની પામીઓને દૂર કરી. અંશુમતે કહ્યું, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સામે અમે જે જોયું તે સ્પષ્ટતાનું પરિણામ છે. નેટ સત્રોમાં સેંકડો વખત, વિવિધ પરિસ્થિતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો. તેણે પાવરપ્લેમાં તેને કેટલા રનની જરૂર પડશે, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેને કેટલા બોલની જરૂર પડશે જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરી. આ બધું માનસિક તૈયારીનો ભાગ હતું. અંશુમતે કહ્યું, કિશનએ અપેક્ષાઓ સાથે સખત મહેનત



કિશનની 'વિન યે યા' સંપૂર્ણપણે બદલાઈ ગઈ. તેણે સારી એકાગ્રતા માટે ધ્યાન કરવાનું શરૂ કર્યું. પિતાની સલાહ પર, તેમણે ભગવદ ગીતા વાંચવાનું શરૂ કર્યું. તેઓ નિયમિતપણે પ્રેક્ટિસ માટે દિવસમાં બે વાર તેમની એકેડેમીમાં જતા. તેમણે તેમના પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક વ્યક્તિગત રસોઈયા રાખ્યો અને બહાર ખાવાનું છોડી દીધું. તેની ઊંંચ અને આરામનું પણ વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરવામાં આવતું હતું. જોકે કિશન જાહેરમાં બોલ્યો નથી, પરંતુ ભારતીય ક્રિકેટ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અંગેના પ્રશ્નો તેમને દુઃખી કરે છે.

અંશુમતે કહ્યું, વિરામ દરમિયાન, તે માનસિક રીતે થાકી ગયો હતો અને તેને આરામની જરૂર હતી. તેણે તેને પોતાની રીતે સંભાળ્યું. તે ક્યારેય લક્ષ્ય નહોતું. પ્રશ્ન એ હતો કે

કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે તેણે ઝારખંડનું નેતૃત્વ કર્યું હતું, ત્યારે પણ તેને ક્યારેય એવું વિચાર્યું ન હતું કે જો તે આ રીતે રમશે અથવા આ રીતે કેપ્ટનશીપ કરશે, તો તે પાછો ફરશે. ભારત માટે રમવા માટે, વ્યક્તિએ નિઃસ્વાર્થ રહેવું પડશે.